

પલાશ

શ્રી જ્યોતિર્લંઘ મેધાષી
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન
સુરેન્દ્રનગર
૧૫ ફેબ્રુઆરી ૨૦૦૩

વર્ષ : ૧

અંક : ૬

તંત્રી : એન. જે. મહિલા
સહ તંત્રી : શી. ટી. દુરીયા
સંપાદક : ડાયેટ પ્રેરિશા, સુરેન્દ્રનગર
ટકનિક : ડી. કે. ગોસાઈ

સર્જકોને

- > શિક્ષકોને પ્રેરણપદાર્થી, વર્ણ શિક્ષણ કર્યામાં ઉપયોગી બને તેવા મૌલિક, સરળ ભાષામાં આભ્યાસપૂર્વ, અનુભવજન્ય, ટૂંકા લેખો આવકાર્ય છે.
- > બાળક, શાળા કે શિક્ષણ કેન્દ્રી વાર્તાઓ - બાળ કાચ્યો, પ્રસંગકથા-ઘટનાઓ, સ્થાનિક પર્યાવરણને અનુરૂપ લેખો આવકાર્ય છે.
- > અન્યત્ર પ્રગટ થયેલ કૃતિ ન મોકલવી.
- > લેખ પ્રકાશન અંગે પત્ર વ્યવહાર ન કરવો.
- > સામયિકમાં પ્રસિદ્ધ થતા વિચાર સાથે તંત્રી સહમત છે તેમ માનવું નહીં.

ચાલો... વસંતના આગમનને વધાવીએ

પત્ર વ્યવહારનું સરનામું :

પ્રતિ,
તંત્રીશ્રી,(પલાશ)
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની સામે,
સુરેન્દ્રનગર - ૩૬૩ ૦૦૧
ફોન / ફેક્સ : (૦૨૭૫૨)૨૨૩૧૭૦
E-Mail : dietsnr@yahoo.co.in

સારસ્વત ભાઈ- બહેન

ચાલો... રિવાજ બઢાવીએ.

આપની શાળામાં અવાર-નવાર શાળામાં મુલાકાતે આવવાનું થાય છે. શિક્ષકોના તાલીમવર્ગોમાં શિક્ષકો સાથે પ્રત્યાયન કરવાનું મળે છે. ધ્યાં બધાં પ્રશ્નો-સમસ્યાઓ રજૂ કરવામાં આવે છે. તેમાં ઉડીને આંખે વળ્ગે તેવી વાત છે તે ડેડ સ્ટોક (Dead Stock) બાબત.

મિત્રો, ડેડ સ્ટોક તે ડેડ સ્ટોક(Dead Stock) નથી તે લાઈવ સ્ટોક(Live Stock) છે. ચાલો આપણે કબાટના તાળા ખોલી નાંખીએ. ધ્યાં બધું સાહિત્ય, સાધન-સામગ્રી અને પુસ્તકો કબાટમાં અંધારામાં ચીમળાઈ રહ્યાં છે. ચાલો તેને બહાર કાઢીએ. શિક્ષક જો શાળામાં સાહિત્ય, સાધન-સામગ્રી અને પુસ્તકોનો ઉપયોગ કરતા થશે તેટલા તે વધારે વિકસશે. આપણે તેના માધ્યમ દ્વારા શાળાના બાળકોને વિકસવા દઈએ.

શાળામાં મળતી શિક્ષક ગ્રાન્ટ અને શાળા ગ્રાન્ટમાંથી શાળામાં જરૂરીયાત મુજબ ખરીદી કરીએ અને ઉપયોગીતાને ધ્યાનમાં લઈને વાપરીએ. ૬૨ વર્ષ શાળામાં ડેડ સ્ટોકમાં ફક્ત વધારો નહિએ પરંતુ લાઈવ સ્ટોકની જેમ તેને પણ નિવૃત્તિ સમય સુધી સમય પત્રકના તાલમેલમાં સાથે લઈએ.

અસ્તુ.

એન. જે. મહિલા

પ્રાચાર્ય

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,
સુરેન્દ્રનગર

સતત શિક્ષણને સથવારે

કે. જે. જોધી

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરેન્દ્રનગર દ્વારા અત્રેની સંસ્થાના પી.એસ.ટી.ઈ. શાખાના પ્રધામ અને દિવિત્ય વર્ષના તાલીમાર્થિઓ માટે સતત શિક્ષણનું આયોજન તા. ૨૦ થી ૨૫ જાન્યુ. ૨૦૦૩ દરમાન પ્રાથમિક શાળા - કણમાદ (મૂળી) સ્થળ પર યોજવામાં આવ્યું.

મૂળી તાલુકાના ચાર ગામ અને ગ્રાંગા તાલુકાના એક ગામની પસંદગી કરવામાં આવી. જેમાં શ્રી. જે. જે. જોધી (પ્રા. શાળા - કણમાદ), શ્રી. એન. કે. રાવલીયા (પે.સે. શાળા - સરલા), શ્રી. એમ. આર. કોરડીયા (પ્રા. શાળા - હુંતલપુર), શ્રી. પી. એમ. મહેતા (પ્રા. શાળા - લીયા) અને શ્રીમતી. એસ. જી. પંડ્યા (પ્રા. શાળા - રાવળીયાવદર) તાલીમાર્થિઓના માર્ગદર્શક તરીકે ફરજ બજાવી.

તમામ તાલીમાર્થિઓનો નિવસ પ્રાથમિક શાળા - કણમાદ ખાતે રાખવામાં આવેલ છતો. તમામ તાલીમાર્થિઓ સાથે તમામ માર્ગદર્શક સાહેબશ્રીઓ પણ સાથે રહ્યાં. આ છ દિવસ દરમાન કણમાદ ગામ ખાતે દરરોજ પ્રભાતકેરી, પ્રામ સકારી તથા શૈક્ષણિક સંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યાં.

ઉપરોક્ત સુચયેલ તમામ ગામોની અંદર કન્યા કેળવણીને લગતા સૂત્રો લખવામાં આવ્યાં. તમામ શાળાઓમાં બાળમેળા અને બાળર મતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. તમામ ગામોની અંદર જન જાગૃતિ અન્વયે રેલીનું આયોજન કરવામાં આવ્યું.

સતત શિક્ષણની સંફળતા આ અંકમાં મુકવામાં આવેલ "એક ધર" તેનું પ્રતિબિંબ સુચયી જાય છે. તમામ તાલીમાર્થિઓએ કણમાદ ગામ ખાતેથી જ્યારે વિદાય લીધી ત્યારે તમામ તાલીમાર્થિઓ, બાળકો તથા સ્ટાફ પરિવારના હૈયા ભીના થયા, આંખોમાં અશુષ્ટ છલકાયાં.

સિનિયર લેક્ચરર, ડાયેટ - સુરેન્દ્રનગર

૨ મૂજી સંખ્યાઓ

ડી. એમ. વાલેરી

અહીં આપેલ ગુણકાર કેટલી સરળતાથી
૧ × ૬૧ = ૦૬૧
૨ × ૬૧ = ૧૨૨
૩ × ૬૧ = ૨૭૩
૪ × ૬૧ = ૪૫૪
૫ × ૬૧ = ૫૫૫

અભિનંદન

હુમાર પ્રા. શાળા, કન્યા પ્રા. શાળા તથા જ્ઞાનદીપ હાઇસ્ક્યુલ અંતર્ગત પ્રજાસત્તાક દિનની ઉજવણી ચુજારવદી (ગ્રાંગા) ખાતે સંયુક્ત રીતે કરવામાં આવી.

ઉપરોક્ત કાર્યક્રમમાં ચુજારવદી ગામના પ્રામજનોએ શિક્ષણની પ્રવૃત્તિઓ માટે રૂ. ૧૫,૦૦૦ એટલી માત્રા રૂક્ય આપીને લોક સહયોગનું ઉત્તમ ઉદાહરણ પુરુષ પાડેલ છે.

તમામ શાળાઓના સંકલન માટે તથા પ્રામજનોએ ડાયેટ પરિવાર વતી હાઈક શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

પ્રા. શાળા - પલાસન (હળવદ)

विचारोना वृंदावनमां (व्याख्यानमाणा)

जिल्ला "शिक्षण अने तालीम भवन, सुरेन्द्रनगर द्वारा जिल्लाना ज डेवलपमेंट / शिक्षणविद्या संस्थयोगी "विचारोना वृंदावनमां" (व्याख्यानमाणा) नु आयोजन करवामां आवेल हतु. तेनो मुख्य आशय ए उतो के अने संस्थामां पी.टी.सी.मां अभ्यास करी रहेला तालीमार्थीओ (भावि शिक्षण) नवा विचारोने ग्रहण करे, नवा विचारोने गति आपे अने नवा विचारथी समृद्ध बने. आ ज्ञानसत्रना ज्ञान यजमां ज्ञान समृद्ध बनवा भाटे अनेक आमंत्रितो / शिक्षको उपस्थित रहया हतां. आ कार्यक्रममां नीयेना वक्ताओंगे विविध विषयों उपर व्याख्यान आय्या.

क्रम	डेवलपमेंट	विषय	तारीख	विशेष उपस्थिति
१.	डा. बाणवंतभाई व्यास व्याख्याता, बी. एड. कोलेज मैत्री विधापीठ-सु.नगर	चालो वधावी लाईमे उगता सूरजना वारसदारोने.	२७/०१/०३ सोमवार	श्री गिरीशभाई गढवी के.नि.(मूणी)
२.	श्री नागछोलभाई देसाई(बाई)	चालो बापांडांनु	२८/०१/०३	श्री बी.अ॒.लंजतराया
	(शिक्षणविद्या, सुरेन्द्रनगर)	बचपण भयावीमे.	मंगलवार	बी.आर.सी.(वडवाळा)
३.	श्री संजय अमराली साहेब एडी.कलेक्टर, सुरेन्द्रनगर	जीवन शिक्षण	२९/०१/०३	श्री सी.अ॒.मक्काणा (कार्यपालक ईजिनेर)
४.	डा.मोतीभाई पटेल(कडा) (शिक्षणविद्या, सुरेन्द्रनगर)	भाषासने जिगवा दे तेवुं	३०/०१/०३	श्री भरतसिंह राणा प्रभुभ (जि.प्रा.शि.संघ)
५.	श्री चदकातभाई व्यास आचार्य, विनय मंडिर ढाई. धरशाळा, वडवाळा	डेवलपमेंट भानवाय भूत्य	३१/०१/०३ शुक्रवार	डा.जे.अ.पटेल दिसर्च असोसियेट श्री.सी.ई.आर.टी.
६.	श्री बालुभाई राशपुरा लोकसाहित्यकार, सु.नगर	लोकसाहित्य अने शिक्षण	०१/०२/०३ शनिवार	पू. नारायण सेवादासजी स्वामिनारायण गुरुकुण

उपरोक्त कार्यक्रममां डायेटना व्याख्यातशीओ द्वारा परिचयविधि तथा स्वागतविधि करवामां आवी. श्री अ॒.जे.मक्काणा साहेब द्वारा वक्ताशीओनु शाल औढाईने संचान करवामां आवुं. समग्र कार्यक्रमना यजमान पटे श्री अ॒.जे.मक्काणा साहेब (आचार्य-डायेट) उपस्थित रक्यां." विचारोना वृंदावनमां" (व्याख्यानमाणा) नु संचालन - संकलन श्री सी.टी.टुडीयाद्वारा करवामां आवुं.

कल्पना चावला (श्रधांजली)

जीवनने तमारी पोतानी रीते अने शरते जीववा माटे प्रबल महत्वाकांक्षानो कोई विकल्प नवी. तेनु जीवंत उदाहरण अने मात्र भारत देशने ज नहि परंतु समग्र विषयमां स्त्रीने गौरव अपावनार कल्पना चावला. अभेरिझी स्पेश शटल कोलंबियानी कल्पनातिकामां कल्पना चावलानु ता. २ फेब्रुआरी २००३ ने शनिवारना रोज़हुः खद अवसान थयुं.

जिल्ला शिक्षण अने तालीम भवन-सुरेन्द्रनगर परिवार स्व. कल्पना चावलाने श्रधांजली व्यक्त करे छ. तेमोना परम आत्माने परम कृपाणु परमात्मा परम शांति भक्ति तेवी डायेट परिवारनी ईश्वर प्रार्थना।

आत्म प्रशंसा छीछरापाणी निशानी छे.

प्राप्ताक्षर
१५ फेब्रुआरी २००३

શિક્ષક અને શિક્ષણ

ડૉ. પી. ટી. પંડ્યા

શિક્ષકને ભારતના ગ્રંથીમુનીઓનો વારસો પરિવર્તનની પ્રક્રિયામાં શિક્ષકે અગ્રેસર થવાનું છે. પોતાની મહિયો છે તે ગમે તે સમયે રાષ્ટ્રના નવનિર્મિશામાં મહત્વના કાર્યમાં નિર્ણાયક બને છે. રાષ્ટ્રના ભાવિ આશાસપદ યુવાનોને ઘડવાનું કાર્ય તેતું છે. સમાજ પાસે રહેલા સંસ્કાર વારસાને ભાવિ પેઢીઓ પાસે લઈ જવાનું ભગીરથ કાર્ય શિક્ષકનું છે.

રાષ્ટ્રની સર્વ વ્યક્તિત્વમાં શિક્ષકની સવિશેષ જવાબદારી હોય છે. રાષ્ટ્રના બાળકોને ચાર્ટ યવાન, જવાબદાર, શાશ્વત અને ઉત્પાદક નાગરિક બનાવી ઉત્તરભેદેશ પોતાના વ્યવસાયમાં જસ્તવત્ત, ચેતનશીલ અને સંયોગનશીલ નાગરિકનું ઘડતર કરવાની જવાબદારી તેની વિકાસશીલ રહેતું જોઈએ. શિક્ષકે વ્યાવસાયિક સજ્જતા છે. સમાજને જેટલો ઉપયોગી ખેતૂત છે. રેટલોઝ ઉપયોગી કેળવવી જ જોઈએ. તેણે સતત અધ્યયનશીલ બનવું શિક્ષક છે. સમાજમાં શિક્ષકના વિવિધ રૂપો છે. સમાજમાં તેતું જોઈએ. શીખવવાની કણ શિક્ષકે જાહી તે વિદ્યાર્થી માટે કાર્ય અને કવિષ છે. શિક્ષકને સમાજ-સુધારક, પ્રેરણાર્ગોત્ત બનવું. જોઈએ. સમાજ-સેવક, પરિવર્તનનો દૂસ અને રાષ્ટ્રનો વિધાતા ગણવાવમાં આવે છે. આદ્ધર સમાજની નવરચના કરવા માટે શિક્ષક, શિક્ષણ અને સમાજનાં ત્રિવેણી સંગમની જરૂર રહેવાની જ. સમાજમાં પરિવર્તન પરિબળ એટલે શિક્ષક. રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં શિક્ષકનાં કાર્ય વિશે મોય્ય જ કહું છે કે "રાષ્ટ્રના પગ તે રાજકારણપેટે એ મીઠકારણ અને માથું એ શિક્ષણ છે."

આજે શિક્ષણ એક મોટા પરિવર્તન આરોગ્યાવીને ઉલ્લભ છે. જ્ઞાન અને માહિતીનો વિસ્કોટ વધતો જાય છે. કોમ્પ્યુટર, ઇન્જિનીયરિંગ, ઇન્ટરનેટ સેવા, વિશ્વવાચી, ધ્યાનાના નેટવર્ક, ટેલીકોમ્યુનિકેશન, સુપર સોનિક, વાહન પરિવહન... આ બધું એટલી હેઠ આગળ નીકળવા લાગ્યું છે કે, બે દેશોની સરહદો, વિચારસરણી કે સંસ્કૃતિનાં લેદ વચ્ચે અંતર ઘટતું જાય છે. વિશ્વવાચું એકબીજાના. સંપર્કમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગણતરીના સમયમાં થઈ શકે છે. પહેલાના રૂઢિગત ખ્યાલો હેઠ બને છે. વિવિધ સમાજના લોક સમૂહમાંથી શાખામાં લોકમાનસમાંથી ભૂસાવા લાગ્યા છે. શિક્ષકે પોતાની આવતા વિદ્યાર્થીને સમાન લોરોઝે સ્વીકારી, સૌને સાથે ઉચ્ચપ્રતિભા પ્રસ્થાપિત કરવા પરિવર્તનની સાથે તાલ રાખી, સૌને સમાન તક આપવાની રહે છે. સાચો શિક્ષક મિલાવીને કદમ-કદમ આગળ વધતું પડે. સતત વિદ્યાર્થીને વિશ્િષ્ટ શાકિત હાંસલ કરવા પ્રેરિત કરે છે. પરિવર્તનશીલ સમય અને સંજોગોના સંદર્ભમાં જેમ-જેમ સમાજને ઈમારત ગણીએ તો શિક્ષણએ તેનો પાયો છે. અને સમાજિક મૂલ્યો બદલાઈ રહ્યા છે. તેમ તેમ શિક્ષણની પાયોનો ચણનાર શિક્ષક છે. સંકલના, સરંજામ અને સજાવત પણ બદલવા ધટે.

નિષ્ઠા અને કર્તવ્યના રંગે સમાજની કાન્નિને વેગ આપવાનો છે. રાષ્ટ્રની બહુલક્ષી વિકાસ અને પ્રગતિની કરી પર ક્ષે કરી રહેલા અસંખ્ય લાયિ નાગરિકોમાં શશ્વતા, આશા અને કર્તવ્યના પ્રચંડ પૂર લાવીને તેમની નેસાર્જિક શક્તિને કાર્યાન્વિત કરવાની કપરી જવાબદારી જો કોઈ વ્યક્તિત્વની સવિશેષ હોય તો તે શિક્ષકની છે.

શિક્ષકે પોતાનું સ્થાન મજબૂત બનાવવા ગયો અને ઉત્પાદક નાગરિક બનાવી ઉત્તરભેદેશ પોતાના વ્યવસાયમાં જસ્તવત્ત, ચેતનશીલ અને સંયોગનશીલ નાગરિકનું ઘડતર કરવાની જવાબદારી તેની વિકાસશીલ રહેતું જોઈએ. શિક્ષકે વ્યાવસાયિક સજ્જતા શિક્ષક છે. સમાજમાં શિક્ષકના વિવિધ રૂપો છે. સમાજમાં તેતું જોઈએ. શીખવવાની કણ શિક્ષકે જાહી તે વિદ્યાર્થી માટે કાર્ય અને કવિષ છે. શિક્ષકને સમાજ-સુધારક, પ્રેરણાર્ગોત્ત બનવું. જોઈએ.

ચચ્ચીલ પોતાના શિક્ષકોને ખુલ્લજ આદર આપતા, બીજા વિશ્વયુદ્ધના અંતે જયારે દેશ હાથો ત્યારે તેમણે કહું હુંકું "મારા સૈન્યનો વિનાસ થયો તેથી મારા દેશનો વિનાસ નહી થઈ જાય, જ્યાં સુધી મારા દેશ કે મારા દેશમાં ઉત્તમ શિક્ષકો છે. ત્યાં સુધી મારા દેશ કે મારા દેશમાં નાગરિકોને કશીજ આંચ આવવાની નથી" વિકસીત રાષ્ટ્રોમાં શિક્ષણ પાણા વધારે ખર્ચ થાય છે. તેણું પ્રમાણમાં લશ્કર પાણા ઓછું ખર્ચ ગાય છે. સંહાર વૃત્તિનો વિકલ્પ સર્જનવૃત્તિ છે.

શિક્ષણની પ્રક્રિયા માનવ સમાજના વિકાસ સાથે સતત સંકળાયેલી રહી છે. માનવ સમાજની સલ્યતાના ઘડતરમાં શિક્ષણાકાર્યનું સવિશેષ પ્રદાન છે. સમયના વહેણ સાથે પ્રચ્યેક પરિવર્તનો શિક્ષણ દારા જગીલવામાં આવે છે. સંકળિત દેશના વિકાસમાં શિક્ષણાનો સ્વશેષ ફળો છે.

શિક્ષણ પ્રક્રિયામાં શિક્ષક પથદર્શક દીવાદાંડુરૂપ સંપર્કમાં થઈ શકે છે. પહેલાના રૂઢિગત ખ્યાલો હેઠ બને છે. વિવિધ સમાજના લોક સમૂહમાંથી શાખામાં લોકમાનસમાંથી ભૂસાવા લાગ્યા છે. શિક્ષકે પોતાની આવતા વિદ્યાર્થીને સમાન લોરોઝે સ્વીકારી, સૌને સાથે ઉચ્ચપ્રતિભા પ્રસ્થાપિત કરવા પરિવર્તનની સાથે તાલ રાખી, સૌને સમાન તક આપવાની રહે છે. સાચો શિક્ષક મિલાવીને કદમ-કદમ આગળ વધતું પડે. સતત વિદ્યાર્થીને વિશ્િષ્ટ શાકિત હાંસલ કરવા પ્રેરિત કરે છે. પરિવર્તનશીલ સમય અને સંજોગોના સંદર્ભમાં જેમ-જેમ સમાજને ઈમારત ગણીએ તો શિક્ષણએ તેનો પાયો છે. અને સમાજિક મૂલ્યો બદલાઈ રહ્યા છે. તેમ તેમ શિક્ષણની પાયોનો ચણનાર શિક્ષક છે. સંકલન : રીકર, જી.સી.ઇ.આર.ટી., ગાંધીનગર

વજાસન :-

કેવી રીતે કરવું :-

આસન પર બન્ને પગ લાંબા કરી બેસો. ડાબા પગને ઢીચાણથી વાળીને ડાબા નિતંબ નીચે ગોઠવો. એ જ રીતે જમણા પગને જમણા નિતંબ નીચે ગોઠવો. બન્ને પગના તળીયા પાછળથી જોઈ શકાશે. સીધા બેસો. બન્ને હાથને બન્ને પગના ઢીચા પર ગોઠવો. આંખો બંધ કરો બન્ને ઢીચા એકબીજા સાથે જોડાયેલા રાખો.

આ આસનથી થતા ફાયદા :-

આ આસનના અત્યાસથી પેટના અવયવોને વધુ લોડી મળે છે. તેથી પાચનતંત્રની કાર્યક્ષમતા વધે છે. વુંટણના સાંધારોને લયીલા બનાવે છે. સાથણ અને નિતંબ પરની વધારાની ચરખીને દૂર કરે છે. જેમને પાચનતંત્રની તકલીફ હોય તેમણે ભોજન પછી આ આસનમાં બેસવું. અજીર્ણ અને વાયુની તકલીફ દૂર કરે છે. આ આસનના અત્યાસથી કમરના દુઃખવામાંથી બચી શકાય છે.

પર્વતાસન :-

આ આસનમાં શરીરનો આકાર પર્વતના શિખર જેવો થાયછે. તેથી તેને પર્વતાસન કહેછે.

કેવી રીતે કરવું :-

આસન પર પગ લાંબા કરીને બેસો. બન્ને પગ પદમાસનની જેમ ગોઠવો એટલે કે જમણા પગ ડાબા સાથળ ઉપર અને ડાબો પગ જમણા સાથળ ઉપર ગોઠવો. સીધા બેસો અને સામે જુઓ. બન્ને હાથે પ્રણામ મુદ્દામાં ગોઠવી આકાશ તરફ ખેંચો સાથે સાથે સમગ્ર શરીરને પણ ઉપર ખેંચો. બન્ને હાથને ઉપરની તરફ લેતી વખતે ઉડો શ્વાસ લો.

આ આસનથી થતા ફાયદા :-

કરોડ૨જીને સીધું રાખવામાં અને શરીરના બાંધાને જાળવી રાખવામાં સહાય કરે છે. શ્વસન ક્ષમતા વધારે છે. પેટ, છાતી, વાસો, કમર, ખબા અને હાથના સ્નાયુઓને ઉત્તમ બાયામ આપે છે. ઉચ્ચાઈ વધારવા માટે આ આસન ઉપયોગી છે.

કિરણો

રચનાત્મકતા :-

રચનાત્મકતાથી "સમય" ની નવી શરૂઆત થાય છે. જ્યારે તમે રચનાત્મક હોવ છો ત્યારે સમયનું કંટાળાજનકે એકધારાપણું ટળી જાય છે. રચનાત્મકતા ઉત્સાહનું મોજું ફેલાવે છે. કુદરતમાં રહેલા રચનાત્મકતા અને સર્જકતાના આવેગો સાથે હુમેશા ઉત્સાહ જોડાયેલ હોય છે. તમે જ્યારે ખૂબ ઉત્સાહમાં હોવ છો ત્યારે અસ્તિત્વના રચનાત્મક સિદ્ધાંતની ઘણા જ નશીકી હોવ છો. ગાઢ મૌન રચનાત્મકતાની જનની છે. જે માણસ અતિશય વ્યસ્ત હોય, ચિંતાતુર હોય, વધારે પડતો મહત્વાંકાશી હોય કે આપણું હોય તે કયારેય રચનાત્મકતા ન હોઈ શકે સમતુલિત પ્રવૃત્તિ આરામ અને યોગ તમારામાં રચનાત્મકતા અને કૈશાયની જ્યોત જગાવશે.

નિગ્રહ, આગ્રહ, સત્યાગ્રહ અને દુરાગ્રહ :-

નિગ્રહ એટલે સંયમ. આગ્રહ એટલે ફરજ પાડવી, સત્યાગ્રહ એટલે અતિશય દઢ નિશ્ચય. દુરાગ્રહ એટલે આંધણી અને હિશાશૂન્ય અકકડાઈ. આ ચારનું તમે જો સીમિત સમય સુધી સેવન કરો તો વિકાસ થશે. તેનું પરિણામ સારું કે નરસુ સીમિત જ હોય છે. પણ જો આ બધુ લાંબા ગાળા સુધી ટકી રહે તો તમારા જીવનની ક્ષમતાઓનો ક્ષય થશે. શાંતિ જોઈતી હોય તો આ ચારેથી ઉપર ઉઠવાની જરૂર છે. મુક્તિ ત્યારે જ છે જ્યારે આ ચારે આગ્રહોથી પરબવ જીવનને આકાર આપવામાં એમનો ફાળો જરૂર છે પણ મુક્તિ માટે તો એ આ ચારેથી દૂર જ જવાનું છે.

ગ્રથપાદ, ડાયેટ-સુરેન્નગર

કવિ/વેખકના તખલુસ

ડાલી મહાવીરચિહ્ન અ.

'અભિજ'	- શ્રી ધનશંકર જિપાઠી	'દિનકર'	- શ્રી રામધારીસિંહ
'અનામી'	- શ્રી રણજીતભાઈ પટેલ	'રામ્ભીય શાયર'	- શ્રી જવેરચંદ મેઘાડી
'અદલ'	- શ્રી નટવરલાલ પંડ્યા	'મૂષળી મા'	- શ્રી જિજુલ્લાઈ બધેકા
'કલાપી'	- શ્રી સુરક્ષિતભી ગોધીલ	'રસબીન'	- શ્રી નાથાલાલ દવે
'કાન્ત'	- શ્રી મણિશંકર રલજી ભડ્ક	'મરીઝ'	- શ્રી અભ્યાસઅલી વાસી
'ધનશામ'	- શ્રી કર્ણાલાલ મુનથી	'દેફામ'	- શ્રી બરકત વિરાધી
'ચાંદામામા'	- શ્રી ચંદ્રવદુન મહેતા	'ધાર્મલ'	- શ્રી અમૃતલાલ ભડ્ક
'ચકોર'	- શ્રી બંસીલાલ વર્મા	'વૈશમપાયન'	- શ્રી કરશનદાસ માણેક ડાયેટ-તાલમાર્થી (દિતીય વર્ષ)
'જીયભિયાનુ'	- શ્રી બાલાભાઈ દેસાઈ		
'જિલ્પી'	- શ્રી ડિસનસિંહ ચાવડા		
'ડોઠ નિશાગીયો'	- શ્રી બહુલ જિપાઠી		
'દંશક'	- શ્રી મનુભાઈ પંચોલી		
'દૂમકેતુ'	- શ્રી ગૌરીશંકર જોશી		
'પારાશર્ય'	- શ્રી મુકુંદરાય પટેલી		
'પ્રેમ ભડીત'	- શ્રી જ્ઞાનાલાલ		
'બાદરાયણ'	- શ્રી ભાનુશંકર વ્યાસ		
'ભુલભુલ'	- શ્રી ડાહયાભાઈ દેરસરી		
'ફિલસૂફ'	- શ્રી ચીનુભાઈ પટવા		
'મકરં'	- શ્રી રમણભાઈ નીલકંઠ		
'હાલિત'	- શ્રી જન્યશંકર બૂઢુ		
'વાસુકી'	- શ્રી ઉમાશંકર જોશી		
'સત્યમ'	- શ્રી શાંતિલાલ શાહ		
'સ્નેહરાશ્મ'	- શ્રી જીણાભાઈ દેસાઈ		
'સુંદરમ'	- શ્રી ત્રિભોવનદાસ લુહાર		
'સેહેની'	- શ્રી બળવંતરાય દાકોર		
'સોપાન'	- શ્રી મોહનલાલ મહેતા		
'શૈવરવિહારી'	- શ્રી રા.વિ. પાટક		
'સાહિત્યપ્રેય'	- શ્રી ચુનીલાલ વી. શાહ		
'સબસાચી'	- શ્રી ધીરુભાઈ ટકર		
'શિવમ સુંદરમ'	- શ્રી ડિમતલાલ પટેલ		
'કાકાસાહેબ'	- શ્રી બાલકૃષ્ણ દાતારેય		
'મસ્તકવિ'	- શ્રી નિભુષનશંકર ભડ્ક		
'કલાન્ત'	- શ્રી બાલશંકર કથારિયા		
'પ્રેમ'	- શ્રી બાલુલાલ શર્મા		
'ઉશનસ'	- શ્રી નટવરલાલ પંડ્યા		

ચાલોને બાળ

- મહાદેવ ડી. અંબારિયા

ચાલો ચાલોને બાળ કૂલ ચુંટવાને,
આનંદ અનેરો આજ લૂંટવાને

ચાલે ચાલોને બાળ

કૂલ ચુંટવાને

હીયશું મોટાં વડલાની જાળે,
બેલશું નાનાં સરવરની પાળે,

રંગિન પરંગિયા પકડવાને,

ચાલો ચાલોને બાળ

કૂલ ચુંટવાને

કોયલ સંગાથે ગીતકા ગાવા,
જરશાનાં નિર્ભય નીરમાં ન્હાવા,

કૂલોનાં રસ મધુર ચુમવાને,

ચાલો ચાલોને બાળ

કૂલ ચુંટવાને

પ્રા. શાળા—નારીચાણા (ગ્રાંગધા)

પ્રતીભાવ

જિશાસુ વ્યક્તિને હતી જેની તલાશ
એ નાવિન્ય પુરુ પાડતું મળ્યું પલાશ

ધમલ નિલા ઓચ.

પ્રા. શાળા—જીવા (ગ્રાંગધા)

કામ વધુ કરો વાત ઓછી કરો.

પલાશ

૧૫ ફેબ્રુઆરી ૨૦૦૩

બાળકને ભયમુક્ત રાખો

— ગિજુલાઈ બદેકા



બીકથી બાળક કરકણ થાય. બીકથી બાળક નામરદ થાય.
બીકથી બાળક હારી જાય. બીકથી બાળક નાસીપાસ થાય.
બીકથી બાળક ડિંમત ખુઅે. બીકથી બાળક પાછળ પડે.
બીકથી બાળક શાંતિ ખુઅે. બીકથી બાળક જાન ખુઅે.
બાળકને કદી ન જિવરાવીએ.

બાળકો તો નાના છે. આપણાથી બળવાન નથી.
આપણી સામે થઈ શકે ઓમ નથી. મારીએ તો રડીને બેસી રહેશે.
કુસકો ભરતાં ચુઈ જશે. ભૂખ્યાં-તરસ્યાં ઉધી જશે.
મારવાથી યાદ નથી રહેતું. મારવાથી કુટેવ નથી ભૂલાતી.
મારવાથી ઠાપક્ષ નથી આવતું.
મારવાથી બાળકનું શરીર ખવાય.
મારવાથી બાળક મારકસું થાય. મારવાથી બાળક બીકણ થાય.
મારવાથી બાળક ખુહું થાય. મારવાથી બાળક લુચ્યું થાય.
મારવાથી બાળક જૂહું થાય. બાળકને કદી ન મારીએ.

અંધારાની બીક નાલપણમાં લાગી., મોટું થતાં ભૂતની બીક., આગળ જતાં વીરની બીક., ત્યાર પછી માતા-મેલની બીક., એમ કરતાં ભગવાનની બીક. એ ચાલી બીક પરંપરા બીક શરીરને નિઃસત્ત્વ કરે છે. મનને નબળું કરે છે. બીધેલું બાળક આંખો બંધ કરે છે. તે બળહીન બને છે., તેનું દૈયું થકડું છે., પરસેવે રેખાલેખ બને છે. મળમુત્ર પણ કરી નાંબેછે! પ્રતેક બીક રામશીના પ્રસંગે બાળકના મોસામે જોવું ને છાતીએ હાથ મૂકવો. બીકની ભયંકરતા સમજાશે.

જે પ્રસંગોએ અર્દેખર જ બીવા જેચું નથી હોતું તે પ્રસંગોએ આપણા વર્તનથી વહી ચાર બાળક બીજું થઈ રહ્યા છે. તેમના થાય તે માટે આપણે કાળજી લેવી જોઈએ. ઉપરાંત સહીસલામતીની ખાતર જ્યાં જ્યાં કાળજી રાખવાની છે ત્યાં ત્યાં નિર્ભયપણે કાળજી કેમ રાખાય તેનો વિચાર બાળકમાં મૂકીએ તો બાળક ખરે વખતે બીકણ થઈને નાસી જવાને બદલે અથવા ભયને શરણે જઈ પડવાને બદલે ભયમાંથી પોતાનું રક્ષણ કરી શકશે.

તમને લાગતું હોય કે બાળકને મારવાથી તેઓ સુધરશે તો તમે એકવાર નહિ પણ અનેક વાર તેમને મારી ઝૂંઝો. વારંવાર મારવાથી પણ જો તેઓ સુધરે નહિ તો તમારે પાંતે જ સુધરવું પડશે. એટલું જ નહિ પણ તમારે તમારા ઝૂંઝ માટે ગ્રાધક્ષિત કરવું પડશે.

આપ આપના બાળકને કદી પણ શિક્ષા ન કરો. શિક્ષાથી બાળકના શરીરને જે પીડા થાય છે તેની બહુ ચિંતા નથી. કારણ મારની શરીર ઉપરની અસર થોડો જ વખત રહે છે. બાળક તે ભૂલી પણ જાય છે તેની બહુ ચિંતા નથી. કારણ મારની શરીર ઉપરની અસર થોડો જ વખત રહે છે. બાળક તે ભૂલી પણ જાય છે, પરંતુ શિક્ષાથી જે ભય ઉત્પન્ન થાય છે તે ભયંકર છે, દુષ્ટ છે. અથને લીધે બાળક પીડાણ, ખોટાંઓનું અને નામર્દ થાય છે. અથને લીધે બાળક આગળ જતા હું રાચારી થાય છે... આજે આપણે બાળકને ભય બતાવી રહ્યાંની શુક્કાએ દ્રીંગે શાખામા શિક્ષણ તેને કરાવી શકે છે. અને પછી પાલીએ કે ગુંડાઓ તેને કરાવી શકે છે. તમે તમારા બાળકને બયપણથી જ ગમે તે રીતે ભયમુક્ત રાખો.

ઓક્પત્ર

તા. ૨૦થી ૨૫ જાન્યુઆરી દરમાન અમારી શ્રી કણ્ઠમાદ ગામની શાળાને આપના કાયેટ તરફથી સતત શિક્ષણનો કે લાભ મળ્યો તે બદલ અમેરી શાળા પરિવાર તથા ગામ લોકો આપના પ્રશ્નાની છીએ. આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.

આપના તાલીમાર્થી મિત્રોના સતત સાંનિધયથી અમારા ગામ લોકો તથા બાળકો એટલાતો પ્રભાવિત થયા કે વર્ષની કરતું પણ અશક્ય વઈ પડે છે. સવારના સાડા છ વાગ્યામાં મંગલ ઘૂનની પ્રભાવતું રહેશે. ગમનું વાતાવરણ પાવનકારી બનાવતા તો સાથે સાથે ગામની સફાઈથી ચોખ્ખાઈના પાઠ પણ શીખવતા. સ્કૂલનું ઘમધમતું શિક્ષણિક કાર્ય, બાળમેળો અને રમતોલ્સવ તથા જનજાગૃતિ રેલીએ અમારી શાળા તથા ગામની રોનક જ બદલી નાખી છે. આ માટે અમો આપના કાયેટ પરિવારના તથા તાલીમાર્થી ઓના ખૂબ ખૂબ આભારી છીએ.

આપના કાર્યોની ગામ લોકો ઉપર એવીતો વિશિષ્ટ અસર પડી છે કે ૨૫ મી જાન્યુઆરીનો પ્રસંગ અમારા માટે ચિરસરણીય બનો રહ્યો. અમે દર વર્ષ ૨૬મી જાન્યુઆરીએ સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજ્જીવે છીએ અને શાળાનું મેદાન પીચો ખીચ જનમેદનીથી ભરાઈ જાય છે. પણ દરવર્ષ બહેનોની સંખ્યા સાવ અંધી રહેતી પરંતુ આ વર્ષ બહેનો અને માતાઓથી આપું મેદાન ભરાઈ ગયું. બહેનોને જાગૃત કરવાનો આ થશ આપના રાત્રી કાર્યક્રમને તથા જનજાગૃતિમાં કંન્યા ડેલાફણી વિશે જે સૂત્રો લખતા તેને જ આભારી છે. આ વર્ષ ૨૫ મી જાન્યુઆરીએ બાળકોને રોકકમાં ૧૬૦૦ રૂ. થી પણ વધારે ઈનામો મળ્યા. બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમને ગમલોકેએ આ રીતે વધાવી લીધો અનો પણ પણ આપના કાયેટના જ ફણે જાય છે. ખરેખર અમારા ગામના શિક્ષણ જગતમાં આ એક અદ્ભુત કાંતિ છે આ માટે પ્રથમ આભાર તો આપનો જ માનીએ છીએ કે અમોને અંધી ગૃહ્ય ફળવ્યા અને નિવાસસ્થાન અમારી શાળાને બનાવી સાથે સાથે શ્રી જોખી સાઢે, શ્રી રાવલીયા સાઢે, શ્રી પીયુષભાઈ સાઢે, શ્રી મનોજભાઈ સાઢે તથા શ્રીમતિ સુમનભેન જેવા આદર્શ માર્ગદર્શકોના પણ અમો આભારી છીએ કે જેમણે પોત પોતાના ગૃહમાં તો કાર્ય કર્યું જ છે સાથે સાથે અમારી કણ્ઠમાદ પ્રા. શાળામાં તથા રાત્રી કાર્યક્રમમાં અમોને સિંહ કાળો આપ્યો છે, સાથે સાથે અમારા રાત્રી કાર્યક્રમમાં હાજરી આપી અમારો કાર્યક્રમ દિપાવનાર કાયેટના પરિવારનો પણ અમે આભાર માનીએ છીએ. સતત શિક્ષણના બધા જે માર્ગદર્શકોનો અને શાળા પરિવાર ગામ લોકો વતી અને પેટા શાળા વતી ખૂબ આભાર માનીએ છીએ.

સાથે સાથે અમારી કોઈ ખૂબ થઈ હોય અથવા સુવિધામાં કોઈ ક્યાસ રહી હોય તો અમે બે હાથ જોડી આપની માર્ગી માર્ગી એ છીએ. 'સ્નેહના સંબંધો છીછરા નથી હોતા' એ ન્યાએ આજે પણ સ્કૂલમાં આપની ઉણાપ વત્તાય છે. દ દિવસથી ઘમધમતી શાળા સુનકાર લાગે છે. રવિવારે ઘજ વંદન વખતે ગામ લોકોએ આપને ખૂબ ખૂબ યાદ કર્યા સાથે સાથે બાળકોએ આંખમાં આંસું સાથે અપોને સવાલ કર્યો કે "હવે નવા સાહેબો ફરી કચારે આવશે?" "પણ વધુ આશ્રય તો ત્યારે થયું કે લોકોના ટોળા વચ્ચેથી પેલા શિવમંહિર વાળા છ - સાત વૃદ્ધ દાદા અમારી પાસે આવીને કહેવા લાગ્યા કે શિવમંહિરમાં પાંચ રાત્રી કાર્યક્રમ જોયા પણી જથારે અમે શનિવારે રાતે ત્યાં બેસવા ગયા ત્યારે ગમયું નહીં અમને પેલા સર્કણ કપડા વાળા ચુવાનો યાદ આવી ગયા, "આટલું બોલતા તો એક રાજપૂત દાદાની આંખો છલકાઈ ગઈ" કદાચ આનું નામ જ લાગડી હશે. અને એટલે જ કવિઓ કહી ગયા હશે કે 'સબસે ઉચ્ચી પ્રેમ સાગાઈ' આવું વાતાવરણ જોઈને મારું હદ્દ પણ ભરાઈ ગયું મનમાં પ્રશ્ન ઉક્ખો કે શુદ્ધ પ્રેમાણ હૃદયવાળા લોકો કળમાદ સીતાય બીજે કંપાં જોવા મળે? પણ સાહેબ આ બધુ આપના કાયેટને જ આભારી છે. અમોને આપના સતત શિક્ષણ કાર્યક્રમથી ઘણું બધુ શીખવાનું, જાગ્રત્વાનું, માણવાનું અને વાગ્યોળવાનું મળ્યું છે. એ માટે અમો આપનો ફરી ફરીને આભાર માનીએ છીએ. સ્ટાફ પરિવાર તથા તાલીમાર્થી ઓને કણ્ઠમાદ પ્રા. શાળા કઢી નહિ ભૂલી શકે. બસ એજ કાયેટ પરિવારને જીય હિન્દ.

આચાર્યશી તથા સ્ટાફ પરિવાર - પ્રા. શાળા - કણ્ઠમાદ (મૂલી)

संकलित शिक्षण

બી. પી. પરમાર

સંકલિત શિક્ષણ એટલે શું ?

વિવિધ પ્રકારની વિકલાંગતા ધરાવતા (દાખિલીન, અલ્પદાખિ, બહેરાં-મુંગા, મંદબુધિ, શારીરિક ખોડાખાંપડા, લર્નિંગ ડિસએબીલીટીઝ) બાળકો પોતાના જ માતા-પિતા સાથે રહીને જ પોતાના જ વિસ્તાર કે ગામની સામાન્ય શાળામાં, સામાન્ય બાળકો સાથે શિક્ષણ મેળવવાની વ્યવસ્થા એટલે સંકળિત શિક્ષણ.

સંકલિષ્ટ યોજના અંતર્ગત વિકલાંગ બાળકોને બળતાં લાભો :

1. વિકલાંગતા અનુસારની તાલીમ મેળવેલ ૧:૧૦ ના રેશીયામાં સહાયક સ્પેશીયલ શિક્ષકની સુવિધા.
 2. પુસ્તકો અને સ્ટ્રોન રી દરેક વિદ્યાર્થી દીઠ રૂ. ૪૦૦-૦૦
 3. યુનિફોર્મ - પ્રત્યેક વિદ્યાર્થી દીઠ રૂ. ૨૦૦-૦૦
 4. સાધનસામગ્રી - વિદ્યાર્થી દીઠ રૂ. ૪૦૦/- પ્રતિ વર્ષ અથવા પાંચ વર્ષ માટે એકસાથે રૂ. ૨,૦૦૦/-
 5. રીડર એલાઉન્સ ડાયિલીન બાળક માટે રૂ. ૫૦-૦૦
 6. રીસોર્સ રૂમ - એક રીસોર્સ રૂમ રૂ. ૩૦,૦૦૦/-
 7. બાળકોના સર્વે તથા મેડિકલ સર્ટી. માટે એક વિદ્યાર્થી દીઠ રૂ. ૧૫૦-૦૦
 8. ઈન્સ્ટ્રુક્શન મટીરીયલ - રૂ. ૫,૦૦૦/- સુધી
 9. હોસ્પિટ ચાર્જ (ભાસિક) વિદ્યાર્થી દીઠ રૂ. ૫૦૦-૦૦
 ૧૦. ગંલીર વિકલાંગતા ઘરાવતા બાળક માટે એસ્કોર્ટ એલાઉન્સ વિદ્યાર્થી દીઠ રૂ. ૭૫-૦૦ પ્રવાસી

प्रवासी शिक्षकनी भूमिका :

સંકલિત શિક્ષણ યોજનાના અમદીક રાણા પ્રવાસી શિક્ષકની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. જેમાં ૮ ટી ૧૦ બાળકોને વિશેષ તાલીમ મેળવેલ હૈશીયલ પ્રવાસી શિક્ષક જુદા જુદા ગામની જુદી જુદી શાળાઓપ્રાણી બાળકોની અહ્વાડિયામાં એક દિવસ મુલાકાત લઈને નીચે મુજબની વિશેષ સહાયક સેવાઓ પૂરી પાડી છે.

૧. વિકલાંગ બાળકોની શોધ અને નોંધણી.
 ૨. સામાજિક શાળાઓમાં પ્રવેશ આપવવો.
 ૩. વિકલાંગ બાળકોના માત્ર-પિતાને માર્ગદર્શનને.
 ૪. વગ્ન શિક્ષક, આચાર્ય અને સહાય્યાભીઓને જરૂરી માર્ગદર્શન, પ્રેરણા અને સલાહ સૂચનો પૂરાં પાડવાં.
 ૫. શાનેન્ડિયોની ઓળખ, મહત્વ અને શૈક્ષણિક કાર્યમાં તેનો મહત્તમ ઉપયોગ.
 ૬. જે તે બાળકને તેની ઇન્ફિક્શન દિનર્યાર્થનું શિક્ષણ આપવું.
 ૭. બ્રેઇલ, ઓરિએન્ટેશન-મોબીલીટી, સાઈન લેંગવેજ, લીપરીડીગ, કોમ્પ્યુનિકેશન સિક્લ, જેવી ક્ષમતાઓનો વિકાસ કરવો.
 ૮. વિશ્વિષ્ટ શૈક્ષણિક સાધન સામગ્રીની ઓળખ કરતાવાલી તથા તેનો ઉપયોગ કરતાં શીખવવો.
 ૯. સહ અભ્યાસક્રમ તથા સહઅભ્યાસ પ્રવૃત્તિઓનું શિક્ષણ આપવું.
 ૧૦. સમાજના સામાજિક વલાકોમાં પરિવર્તન આશાવું.

લેક્ચર ૨, કાયેટ-સૂરેન્દ્રનગર



કોમ્પ્યુટર શીખવું છે ?

- હિપ્પ ગોસાઈ

જાન્યુઆરીના અંકમાં આપણે કોમ્પ્યુટરના સી.પી.યુ. અને મેમરી માપવાના યુનિટ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. હવે આપણે મેમરી(સંગ્રહક) વિવિધ પ્રકાર વિશે માહિતી મેળવીશું. કોમ્પ્યુટરના જે ભાગમાં માહિતીનો સંગ્રહ થાય છે. તે ભાગને મેમરી કહે છે. મેમરીના પણ જુદા જુદા પ્રકારો છે. જેમાં પ્રાઇમરી મેમરી (ચલોલચકો) રેકન્ડરી મેમરી (ફલોપી ડિઝ્ક, હાર્ડ ડિઝ્ક, ચીડી-રોમ) છે જે વિગતે નીચે દર્શાવેલ છે.

પ્રાઇમરી મેમરી :-

(૧) ROM (Read Only Memory) : - તેનું પુરું નામ 'રીડ ઓનલી મેમરી છે' તેના નામ પ્રમાણે તેમાંથી ડેટા/માહિતી વાંચી શકાય છે, પરંતુ તેમાં માહિતી લાખી શકાતી નથી. (તેમાં માહિતી કોમ્પ્યુટર બનાવતી વખતે જ લાખી લેવામાં આવે છે.) તેમાં કોમ્પ્યુટરને ચાલુ થવા માટેની જરૂરી માહિતી(ફાઈલો) હોય છે. ચાલુ કોમ્પ્યુટરે લાઈટ જતી રહેતો પણ તેમાં રહેલી માહિતી જતી રહેતી નથી.

(૨) RAM (Random Access Memory) : - રેમએ કોમ્પ્યુટરનું પ્રથમિક માહિતી સંગ્રહક ગણાય છે. એટલે કે કોમ્પ્યુટરમાં થતી પ્રદ્ઘિયાઓ સૌં પ્રથમ આ મેમરે મારકફત થાય છે., એટલે જ કોમ્પ્યુટરની ઊકપનો આધાર આ મેમરીની ક્ષમતા પર પણ રહેલો છે. એટલે કે તે કામ ચલાઉ મેમરી છે. તથા લાઈટ જાય તો તેમાં રહેલી માહિતી નાશ પામે છે. આમ તે નાશવંત મેમરી છે. રેમની ક્ષમતા 16 MB, 32 MB, 64 MB, 128 MB, 256 MB સુધીની હોય છે.

રેકન્ડરી મેમરી :-

(૩) હાર્ડ ડિઝ્ક (HARD DISK) : - હાર્ડ ડિઝ્ક એ સી.પી.યુ.ના મેમરી ભાગમાં આવેલ સેનેટિક ડિઝ્ક છે. તે કોમ્પ્યુટરની કાયદી, સ્થાયી તેમજ ધારી વધારે સંગ્રહકમતા ધરાવતી મેમરી છે. ઓપરેટેટર સિસ્ટમ દ્વારા તેને C.D; (C ફ્રાઈવ / D ફ્રાઈવ) વગેરે સંજાથી દર્શાવાય છે. તેની સંગ્રહકમતા 1 GB, 2 1 GB, 8 4 GB, 12 GB, 20 GB, 40 GB એ અમારો હોય છે. તેની ક્ષમતા વધારે છે પણ તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરણતાથી લઈ જઈ શકાતી નથી તેને માટે ફલોપી અથવા ચીડીનો ઉપયોગ થાય છે. (ક્રમશ:).

'મા' - સ્તર (શિક્ષક)

- સી. ટી. ટુંડ્રિયા

'મા' ના 'સ્તર' થી બાળકી જોડે વાત કરી શકે તે સાચો માસ્તર. શિક્ષકે બાળકોમાં ભવિષ્ય જોતું જોઈએ. બાળકની આંખમાં સાત અજાય બી નહી પણ અગાંગિત, વિચારો રહેલા છે. ઈશ્વર નિરાકાર છે, તેની સાક્ષાત્કાર બાળકોમાં થાય છે.

શિક્ષક એટલો કદક ન હોવો જોઈએ કે બાળકો તેની પાસે આવતા પણ કરે અને શિક્ષક એટલો બધો ઢીલો પણ ન હોવો જોઈએ કે કોઈપણ વિદ્યાર્થી કે વાતી તેની ટોપી ઉડાડે. પોતાની મર્યાદા જાળવીને સૌના મનગમતા થયું એ એક અનોખી કલાછે.

સાહુ શીલવાન હોય છે, પ્રજ્ઞાવાન જ્ઞાની હોય છે, મા દયાળું હોય છે. આ ત્રણે બાબતોની ગંગોની એટલે શિક્ષક. આ ચુણો જે શિક્ષક પોતાનામાં સ્વયં સ્થિષ્ટ કર્યા હોય તેનો સમન્વય સાચ્છે હોય તે શિક્ષક એક સાચો કલાકાર બની રહે છે. સાચો શિક્ષક સમાજને ગૌરવનેર કહી શકે કે-

"હું શિક્ષક છું, હું ઉપયોગી છું, અજિન સમ અન્ન પકાવું છું.. (પણ) ગજવામાં મૂકવા ઈચ્છનારને દાહક થઈને દાંદાંકુંછું!"

"શિક્ષણ વહેતું મુજબ નસનસમાં,
શિક્ષણ શરીરના કાંડકણમાં,
શીખવું છું 'મા' ના 'સ્તર' જઈ,
'માસ્તર' માં ગૌરવ માનું છું!"

વેક્ચરર,
ડાયેટ - સુરેન્દ્રનગર

બાળકોની બોલીમાં પંખીઓનો કલારવ સમજે,

તરવારાટમાં પરંચિયાની ઉડાઉ નિહાળે,

ઉષ્ણોલાસરમાં લહે રોણો સાગર જુઓ,

છાસ્યમાં ખીલેલા પુષ્પોની પ્રસંગના માણી,

નિદોર્ધ અને નિર્મિણ આંખમાં પ્રભુ દર્શન કરે તે

'સાચો શિક્ષક'

સંકલન : ડી.કે.ગોસાઈ

કૂતરાની માનવતા (વાત)

જે. પી. જાની

એક માણસે એક કૂતરાની વાત લખી હતી કે એ પોતાના કૂતરાને નિયમ પ્રમાણે રોટલો આપતો. પણ એ છેલ્લા બે-ચાર દિવસ થયાં, રોટલો ખાવને બદલે દાટી દેતો અને પછી કોણ જાણે કયારે, એ રોટલો ઉપાડીને કાંક દોડી જતો.

આ પ્રમાણે એને બે-ચાર દિવસ દોડતો જોયો. એટલે પેલો માણસ એની પાછળ પાછળ ગયો.

તો પેલા કૂતરાએ એક અવાવરુ જેવા કુવા ઉપર જઈને કાંકીક ભસવાનો અવાજ કર્યો. અને તરત જ અવાવરુ કુવામાંથી જવાખમાં હોય તેમ અવાજ આવ્યો.

પેલો માણસ તો નવાઈ પામી ગયો. જઈને જુદે છે, તો પોતાના પાળેલા કૂતરાએ રોટલો અંદર ફેડી દીધો હતો. અને અંદરનો એક કૂતરો એ રોટલો ખાઈ રહ્યો હતો.

આ અજાણ્યો કૂતરો અચાનક આ અવાવરુ કુવામાં પડી ગયો હોય, અને પછી બહાર નીકળવાનું ન મળતા, એમાં જ પદ્યાં પદ્યાં, એણો પોતાની વાત કહેવા માંડી હતી.

એ વાત આ કૂતરાએ સાંભળી. અને એ પોતાના ભાગનો રોટલો, આ અંદર પડેલ કૂતરાને જીવતો રાખવા માટે, હગેશાં આંદી આવીને અંદર નાખી દેવાનો રિવાજ રાખ્યો. આ અવાવરુ કુવામાં પડેલા કૂતરા એ જીવતો રાખી રહ્યો હતો.

કૂતરાની આ માનવતા જોઈને પેલા માણસને ઘણું લાગી આવ્યું અને એણો પોતાના સાથીદારોની મદદ લઈને પેલા કૂતરાને અંદરથી કાઢ્યો.

વાલીઓને મારી વિનંતી છે કે તે તે તમારાં બાળકોને માયકંગલાં ન બનાવતા, પણ ટાઈ-તાપ તથા ભૂખ-તરસ વેઠી શકે એવાં બનાવજો. તેમને બરાબર ખવડાવજો પણ કામ કરાવતી વખતે દયા ન ખાતાં. તમારાં બાળકોને મિલકતના વારસ નહીં, સદ્ગુણના વારસ બનાવજો.

- રવિશંકર મહારાજ

૧૧

જે આંશ પાળે તે જ હુકમ કરી શકે.

ચાલો પ્રયોગ કરીએ

લીયાકત હુસેન ધારાણી

હેતુઃ—નિસ્યંદન થી શુદ્ધ પાણી મેળવવું
સાધનો:—ઈન્જેક્શનની બે ખાલી શીશી, વાલટયુબ,
મીણબતી, ખાલી રીફીલનો ટુકડો.

પદાર્થ:—મીઠું, પાણી.

રીત:—


ઈન્જેક્શન ની એક ખાલી શીશી લઈ તેના બુચમાં એક કાણું પાડી ખાલી રીફીલનો ટુકડો નાખો. રીફીલનાં બહારના છેડાપર વાલ ટયુબનો દોઢું કુટ જેટલો ટુકડો ચકાવો. ટયુબનો બીજો છેડો બીજી ખાલી શીશી માં રાખો. હવે રીફીલ વાળી ઈન્જેક્શનની શીશીમાં મીઠાનું દ્રાવકા અફથે સુધી ભરો. રીફીલનો છેડો દ્રાવકાથી થોડો હુરરહે તેમ રાખો. હવે સણીયાની મદદથી શીશીને મીણબતી ની જયોત પર રાખો.

પાણીની વરાળ થતા તે વાલ ટયુબ મારફતે બીજી શીશી તરફ જશે. વાલ ટયુબ પર ઠંડા પાણીનું કપણું મુકો.

અવલોકન:—થોડી વારમાં બાજુની શીશીમાં પાણીના વીપાં પડતા દેખાશે.

નિર્ણય:—નિસ્યંદનની છ્યાથી શુદ્ધ પાણી મેળવી શકાય છે.

આકૃતિ:—



— "શીશી"

શિક્ષક, કુ. શાળા નં. ૭, વડવાણી

"પલાશી"
૧૫ ફેબ્રુઆરી ૨૦૦૩

સંતથા સમાચાર

એમ. બી. પંડ્યા

જે. એમ. પટેલ

- "શિક્ષણમાં ગુણવત્તા સુધારણા કાર્યક્રમ" (લીજો તબક્કો) ના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી એન. જે. મકવાણા સાહેબ ખમીસણા (વઠવાડા) મુકામે ઉપસ્થિત રહ્યાં. (તા: ૧૭ જાન્યુઆરી ૨૦૦૩)
- પી. ટી. સી. પ્રથમ/દ્વિતીય વર્ષના "સતત શિક્ષણ" નું આયોજન મૂળી તાલુકાના કણમાદ મુકામે કરવામાં આવ્યું. સતત શિક્ષણના કન્વીનર તરીકે શ્રી જે. જે. જોખી સાહેબ દ્વારા આયોજન કરવામાં આવ્યું. (તા: ૨૧ થી ૨૫ જાન્યુઆરી ૨૦૦૩)
- ધોરણ-૭(સંસ્કૃત) નિવાસી તાલીમના ત્રણ વર્ગનું આયોજન ડાયેટ પર કરવામાં આવ્યું. આ તમામ વર્ગનું સંચાલન શ્રીમતી સોનલબેન ગૌંડાણ દ્વારા કરવામાં આવ્યું. (તા: ૨૦ થી ૨૫ જાન્યુઆરી ૨૦૦૩)
- માન. શ્રી ઈ. પી. ટી. પંડ્યા સાહેબ (રીકર, જી.સી.ઈ.આર.ટી.) દ્વારા ડાયેટ ની સૌજન્ય મુલાકાત લેવામાં આવી. સંસ્કૃતના નિવાસી તાલીમ વર્ગમાં માર્ગદર્શન પણ તેમના દ્વારા આપવામાંઆવ્યું. (તા: ૨૫ જાન્યુ ૦૩)
- જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાતે પ્રજાસત્તાક હિનની ઉજવણી કરવામાં આવી. શ્રી એન. જે. મકવાણા સાહેબ (પ્રાચાર્ય-ડાયેટ) દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું. (તા: ૨૫ જાન્યુઆરી ૨૦૦૩)
- "વિચારોના વૃદ્ધાવનમાં" (વ્યાખ્યાનમાળા) નું આયોજન કરવામાંઆવ્યું. જેમાં જિલ્લાના શિક્ષણવિદ્યો દ્વારા વિચારોના વાવેતર કરવામાં આવ્યાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી એન. જે. મકવાણા સાહેબના માર્ગદર્શન નીરે સી. ટી. ટુંડીયા દ્વારા કરવામાં આવ્યું. (તા: ૨૭ થી ૧ જાન્યુ/ફેબ્રુ-૦૩)
- UNICEF આયોજિત તાલીમ વર્ગ જેન દેરસર-ડોણીયા (સાયલા) પાતે યોજવામાં આવ્યો. ઉપરોક્ત તાલીમ વર્ગમાં શ્રી એન. જે. મકવાણા સાહેબ દ્વારા ડાયેટ દ્વારા યોજાતી તાલીમ વર્ગ અને તાલીમની જરૂરીયાત અંગે માહિતી આપવામાં આવી. (તા: ૫ ફેબ્રુઆરી ૨૦૦૩)
- શ્રી લ.ન. પુ. મૈત્રી અધ્યાપન મંદિરના તાલીમાથીઓ (તમામ) તથા શૈક્ષણિક સ્ટાફ પરિવાર દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની મુલાકાત લેવામાં આવી. તાલીમાથીઓ સમક્ષ શ્રી એન. જે. મકવાણા સાહેબ (પ્રાચાર્ય) તથા શ્રી ધામી સાહેબ (આચાર્ય) દ્વારા શિક્ષણના કટૃત્વ અંગે માર્ગદર્શન આપવામાંઆવ્યું. (તા: ફેબ્રુઆરી ૨૦૦૩)
- શ્રી. સી. ઈ. આર. ટી., ગાંધીનગર દ્વારા ટેલીકોન્ફરન્સનું આયોજન "પ્રવૃત્તિમય વિજ્ઞાન શિક્ષણ" અન્વયે યોજવામાં આવી. આ કાર્યક્રમનું સંચાલન શ્રી પી. એમ. મહેતા દ્વારા કરવામાં આવ્યું. (તા: ૧૧ ફેબ્રુઆરી ૨૦૦૩)

સ્ટેમ

O. I. G. S. Printed Matter Book-Post

રદ્દાન:

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,
શ્રી સ્વધારિતાયાદ ગલ્ફ સ્ટેમ,
સુરેન્દ્રનગર
પદ્ધતિ: ૩૬૩ ૦૦૧

ન. એન્ટર / પ્રાથમિક શાળા,

તાદ્દુકો: _____
લિન. સુરેન્દ્રનગર.